



ROYALE MANOR
Hotels and Industries Ltd.

Date: 09th August, 2022

To,
The Department of Corporate Services,
BSE Limited
Ground Floor, P. J. Tower,
Dalal Street, Mumbai- 400 001,
Maharashtra, India

(Ref: Script Code No.: 526640)

Subject: Intimation of Publication of Standalone Unaudited Financial Results for Quarter ended 30th June, 2022 in Newspaper.

Respected Sir/Madam,


Pursuant to Regulation 47 of SEBI (Listing of Obligation and Disclosure Requirements) Regulation, 2015, the Unaudited Financial Results (Standalone) for the Quarter ended 30th June, 2022 were duly published in following newspaper:

1. Western Times (Gujarati)
2. Western Times (English)

The copy of published Results is enclosed for your reference.

Kindly consider the same and take on record.

For Royale Manor Hotels and Industries Limited



Somya Singhal
Company Secretary



(Encl. as above)

Prudent financial management helps Reliance Jio reduce running costs

New Delhi, Aug 8 (IANS) Reliance Jio Infocomm Limited repaid entire deferred liabilities pertaining to spectrum acquired in auctions of year 2014, 2015, 2016 and the spectrum acquired in year 2021 through trading of right to use with Bharti Airtel Limited aggregating to Rs 30,791 crore (including accrued interest) in FY22.



cost-effective diagnostic kits called 'R-Green' and 'R-Red' pro one. These kits have received ICMR approval and showed a high degree of accuracy and specificity during validation studies.

Reliance has also collaborated with IITM-CSIR (Jammu) to develop an RT-LAMP kit to facilitate the point-of-care diagnosis of COVID-19. The R&D team actively contributes to the company's technical wisdom to facilitate innovation globally by publishing research articles on diagnostics and treatment. Application of natural-antibiotic xanthin for COVID-19 management published in 'Biomedicine and Pharmacotherapy' journal is recognised as top 100 research paper. The paper is listed in WHO's global repository.

PSA based oxygen concentrators can produce oxygen with 93 per cent (~3 per cent) purity. The unit is an excellent solution during hospitalisation due to COVID-19 to maintain the SpO2 level of a patient.

US Senate passes Biden's modified inflation reduction bill as part of Build Back Better initiative

By Ashe O Washington, Aug 8 (IANS) The US Congress moved much closer to the passage of President Joe Biden's much-articulated but modified Build Back Better (BBB) initiative on climate, healthcare and tax spending as bittersweet as the Senate worked through a series of amendments to a wide-ranging bill that was eventually adopted by the Senate with 50 votes plus the tie-breaking ballot by Vice President Kamala Harris.

For Democrats, the long hours paid off when the Senate on Sunday night eventually passed the inflation reduction bill originally proposed by Biden and adopted with several amendments, including those by Senators Joe Manchin and Krysten Sinema on the financial provisions, a USA Today report said. According to the report, the Senate saw a rare weekend session for the Democrats push hard to pass their ambitious bill before leaving Capitol Hill for their traditional August recess.

Democrats advanced the bill, called the Inflation Reduction Act, through the budget reconciliation process, which means they had to clear a few procedural hurdles to send the bill to the House for expected passage and eventually the President's desk. The Democrats in our Senate caucus have stayed unified throughout the night, Senator Chris Coons told ABC News during a break between votes. "Every single amendment vote of the dozens we've taken so far we've defeated Republican efforts to knock down this effort, even landmark piece of legislation that will reduce prescription drug prices, real health care costs, reduce the deficit and make a big down payment on combating climate change."

close to \$740 billion in new tax revenue over the next supposedly 5 to 10 years, but most certainly it's not going to help get us through a recession at a time when we're worried about what's the budget reconciliation process. Senate Democrats used the budget reconciliation process to move the bill, although they avoid the 60-vote threshold to overcome a Republican filibuster. The process allowed the bill to pass with 50 votes, meaning all they needed was a strict-party line vote with their 50-50 majority (Vice President Harris cast the tie-breaking vote). No Republicans supported the final version.

The process had one major caveat: provisions in the bill must be related to the budget in some capacity. Any bill that is on track to reconciliation must first go through the Senate Parliamentarian, who combs through the bill for any violations of what's been dubbed the Byrd Rule. It was named after Virginia Democratic Senator Harry F. Byrd, considered a fiscal hawk.

Business Brief

JioGames launches streaming platform 'JioGamesWatch'

Mumbai, JioGames is a one-stop platform that has revolutionized the online gaming space in India. The platform offers something to everyone from gamers, esports athletes, and casual gaming enthusiasts to game publishers, and developers. Now, JioGames aims to bring an immersive and interactive game streaming experience through the click of a button across multiple Jio devices, with the introduction and launch of its streaming platform - JioGamesWatch. JioGamesWatch's launch comes after a deep dive into the likes and preferences of the gaming community. The platform has set its sights on empowering and enabling creators to go live with any device, under any network, and showcase the best of their content to millions of viewers. Furthermore, several viewer engagement tools enable creators and influencers to stay ahead of the competition, such as audience polls, & Emotes.

Higher edtech platform upgrad bucks trend, raises Rs 1,670 cr

Mumbai, Aug 8 (IANS) Online higher education platform upgrad on Monday said it has raised \$210 million (about Rs 1,670 crore) in a round that saw participation from ETS Global, Bodhi Tree, Kaizen Management Advisors and others - at a time when the Indian edtech companies are facing layoffs and employees amid the ongoing funding winter.

Founder Group also invested \$12.5 million in the funding round to maintain their over 50 per cent ownership in upgrad, the company announced. The edtech company said it is on track to record annual gross revenue of 5400-5000 million during FY23, out of which about 45 per cent of total revenue will be realised from courses and programmes. Higher edtech will be on the rise for the next 4 to 5 decades, upgrad, in the last 12 months, has re-shaped itself to be the most integrated company in this space with career opportunities for college learners and working professionals," said Upgrad Co-founders, Ronnie Screwala and Mayank Kumar.

Air India to induct wide-body aircraft into its fleet

New Delhi, Aug 8 (IANS) With a view to expand its network, Air India has planned to induct wide-body aircraft into its fleet. Total 10 aircraft will be brought back into service by early 2023. A wide-body aircraft is generally deployed on international routes as its bigger fuel tank allows it to travel on long-haul international routes like India-US and India-Canada.

Air India's wide-body fleet currently stands at 43 aircraft, of which 33 are operational. This is a significant improvement from 28 aircraft that the airline was operating till recently. The airline on Sunday also announced that it will operate daily flights between Delhi and Vancouver (Canada) from August 31 onwards. Currently, it operates Delhi-Vancouver service five times per week. Frequency on this route has been increased keeping in view the growing traffic between India and Canada and has been enabled by the return to service of the wide-body Boeing 777-300ER aircraft. The airline said that Boeing has been working closely with Air India following its acquisition by Tata Group to restore aircraft that had been grounded for prolonged periods due to the COVID-19 pandemic and other reasons.

Benelli-Keeway Opens Exclusive Showroom at Ahmedabad

Ahmedabad, To strengthen its presence in Gujarat, Benelli Keeway India has inaugurated a new dealership in Ahmedabad. Located at D-1, 21 Titanium Square, Thaltej crossroads, Sarkhej Gandhinagar Hwy, Ahmedabad, Gujarat 380054, the brand new state-of-the-art facility is designed to support sales, service, and spares in Ahmedabad. The sales touchpoint is operated under the leadership of Shashi Harshadha Padia, Dathawala Automotive Pvt Ltd. With this new outlet, Benelli Keeway India has a strong network of 52 touch points across the country. The facility would highlight the range of superbikes as well as products from the recently launched Hungarian marque Keeway. The 35

Housing loan disbursements grow in tier 3, 4 cities with more female borrowers

Chennai, Aug 8 (IANS) With the implementation of Survey of Villages Abadi and Mapping with Improved Technology in large Areas (SVAMITVA) scheme and work from home culture getting in vogue there is a spurt in housing loan demand in tier 3 and 4 districts. The growth has been registered more in the female borrowers, said State Bank of India (SBI) in a research report.

The number of female housing loan borrowers increased significantly in FY22 in tier 3 and tier 4 districts. Among the top 20 districts with highest share of female borrowers in fresh home loan disbursement in FY22 (which are mostly rural), six districts are from Chhattisgarh and three from Gujarat and Haryana each, SBI said.

According to the report, the housing loan portfolio of the banks grew by more than 10 per cent in FY22, with tier 3 and tier 4 areas

growing at a much faster rate than tier 1 and tier 2 districts post pandemic. Further, the housing prices have also shown a significant increase in the tier 3 and 4 cities than in major cities over the last year. The combined share of tier 3 and tier 4 districts in fresh housing loan disbursement, though small, has also been growing steadily over the years. The now grown to 36 per cent in FY22 compared to 32 per cent in FY19, the SBI said.

This rising home loan demand in rural districts can be attributed to the SVAMITVA scheme provided rural people with the right to document their residential properties which can help them to use their property for economic purposes. According to SBI, Haryana and Uttar Pradesh, where this scheme has already covered many villages, has seen a rise in where home loan disbursement is increasing at a faster pace. The Central government schemes like AARU, PMAY(U) and Smart Cities

GUJARAT CONTAINERS LIMITED
CIN: L28120GJ1992PL017081
Regd. Office: Plot no. 448, Baroda - Savli Highway, Vill. Tundlav, Tal. Savli, Dist. Vadodra - 391 775, Tel: (2607) 252084, 262220
Email: info@gujaratcontainers.com Website: www.gujaratcontainers.com

NOTICE
Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the Meeting of the Board of Directors of the Company's scheduled to be held on Saturday, 13th August, 2022 at 4.30p.m. onwards at its Corporate Office at 201-202, Alkapuri Arcade, "B" Wing, R.C. Dutt Road, Opp. Welcome Hotel, Vadodra - 390 007, to consider inter alia,
1. The Standalone Unaudited Financial Results for the 1st Quarter ended 30th June, 2022
2. Date, time and place to convene 30th Annual General Meeting of the members of the Company
3. To fix the date of Closure of Register of Members and Share Transfer Register of the Company
4. To consider and approve Board's Report
This information is also available on the Company's website www.gujaratcontainers.com and BSE website www.bseindia.com
For Gujarat Containers Limited Sd/-
Date : 02-08-2022 Narendra D. Shah
Place : Vadodra Company Secretary & Compliance Officer

MENA MANI INDUSTRIES LIMITED
Regd. Office: 4th Floor, "KARIM" Corporate House, Opp. Viharangam, No. Newkottur, Thiruvananthapuram, Kerala - 695 016
Gujarat, Phone : 079-26938006 • CIN : L28199GJ1992PL018847

STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022

Particulars	Quarter Ended		
	30/06/2022 (Unaudited)	31/03/2022 (Audited)	30/06/2021 (Unaudited)
Total Income from operations	211.52	266.63	146.22
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(21.48)	144.35	(5.82)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(21.48)	144.35	(5.82)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(21.48)	116.72	(5.82)
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	1003.47	1003.47	1003.47
Equity Share Capital	(21.48)	116.72	(5.82)
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualized)	(0.21)	1.16	(0.06)
Diluted:	(0.21)	1.16	(0.06)
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualized)	(0.21)	1.16	(0.06)
Diluted:	(0.21)	1.16	(0.06)

NOTES : The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites (www.bseindia.com) and the company's website (www.menamani.com)

For MENA MANI INDUSTRIES LIMITED
Sd/- Swaminik M. Patel
Place : Ahmedabad (Managing Director) DIN : 0016551

WESTERN RAILWAY - VADODARA
NATIONAL SCHOOL OF HUMAN RESOURCES, VADODARA
ENGINEERING DEPARTMENT
E-TENDER NOTICE NO. NAIR-SPCE-CAMPUS-2022-23
On behalf of the President of India are invited by Sr. Professor (Civil Eng.) National Academy of Indian Railway, Lal Bahug, Vadodra-390 004 for the following works: Name of Work & Tender No.: Maintenance of Gardens, Lawns and surrounding area in the campus of National Academy of Indian Railway, Lal Bahug, Vadodra for 23 months. Tender No. NAIR-SPCE-CAMPUS-2022-23-1. Approximate cost of the work is Rs. 65,70,000/- Bid Security to be deposited of Rs. 600,000/- Date and time for submission of e-tender and opening of e-tender: Online Tender is to be submitted on 08.09.2022 before 15:00 hrs. and to be opened on 08.09.2022 at 15:30 hrs. Web site particulars and notes for location where complete details can be seen etc.: Website www.iraps.gov.in National Academy of Indian Railway, Lal Bahug, Vadodra - 390 004. 094

INDO CREDIT CAPITAL LIMITED
Regd. Off.: 304, Kalang, 8th, Baroda City, N. M. Carmel School, Ashram Road, Ahmedabad 380009
www.indocredcapital.com email: indocred@rediffmail.com Tele Fax: 079-26580366

Extract of Unaudited Financial Results for the Quarter ended 30th June, 2022

Sl. No.	PARTICULARS	(Rs. In Lacs)		
		Quarter Ended 30/06/2022 (Unaudited)	Year Ended 31/03/2022 (Audited)	Quarter Ended 30/06/2021 (Unaudited)
1	Total Income from Operations (Net)	0.00	3.27	0.00
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	-3.11	-7.07	-1.88
3	Net Profit/(Loss) for the period before Tax (After exceptional and/or Extraordinary Items)	-3.11	-7.07	-1.88
4	Net Profit/(Loss) for the period after Tax (After exceptional and/or Extraordinary Items)	-3.11	-7.07	-1.88
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	-3.11	-7.07	-1.88
6	Equity Share Capital	723.08	723.08	723.08
7	Reserves (Excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	-113.92	-113.92	-106.85
		(As on 31-03-2022)	(As on 31-03-2022)	(As on 31-03-2021)
8	Earning Per Share (of Rs. 10/- each) (Not annualized) Basic (Rs.) Diluted (Rs.)	(0.04) (0.04)	(0.10) (0.10)	(0.03) (0.03)

Notes:
1. The aforesaid results of the Company were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 08th August, 2022. The statutory auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.
2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com and on company's website www.indocredcapital.com.
3. The Previous year/period figures have been regrouped/rearranged, wherever necessary to make them comparable with the current period figures.

For and On Behalf of the Board of Directors
INDO CREDIT CAPITAL LIMITED
Date : 08.08.2022 Place : Ahmedabad
Ramkran M. Saini Director (DIN: 00439446)

SHREE N.M.GOPANI POLYTECHNIC INSTITUTE
Managed by Ranpur Sarvajani Education Society
AICTE Approved, QCI affiliated & ISO Certified Institute
Ranpur - Knera-382245, Dist-Bardoli
Email: ranpur@nmgoinstitute.com Website: www.nmgoinstitute.com Phone: 9899752200

Faculty Appointment

	Principal-01	H.O.D	Lecturer
Diploma Engg	01	04	
Automobile	01	04	
Civil	00	03	
Electrical	01	03	
Mechanical	01	02	

Qualification: Experience & pay Scale as per AICTE & GTO norms
Interested Candidates send their application to the Director as per above mentioned address with photograph & Necessary Document up to 29/08/2022. The no. of Vacant post may be change according to requirement.

ARCHIT ORGANOSYS LIMITED
Regd. Off.: Plot No. 25/9/A, Phase-III, GIDCO, Ahmedabad-382330, Ph: 079-40082447
CIN: L24110GJ1999PL018441
PUBLIC NOTICE
NOTICE is hereby given that the 25th Annual General Meeting (AGM) of Archi Organosys Limited will be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM), in compliance with the provisions of the Companies Act, 2013 and the Companies (Meetings of Members) Rules, 2014. The AGM shall be held on Thursday, 08th day of September, 2022 at 12:35 p.m.

